

" □□□ □□□□□ □□□□ □□□□ □□□ □□□□ □□□□□□ ."

□□□□□□ □□□□□□□□□□ □□□□ □□□□□□□□ □□□□□□ □□□□□□.

ભચ્ના પહેલા સ્પૂઠાતના સહાયત સંઘની ઘોષણા ટેસીડેન સી ક્લબ, પુણેમં ૧૫મી પૂ થલિ, ૨૦૦૧ થી.

□ ક નવી સંકલ પના શસ ત્ થક થયાના આગમની સાથે અથ થત gastroplasty અથ્મા પેટને સીવવુ, બેમથ વધથે વજનવાળા લોકો મટે □ ક નવી જીદગી ડેડાથમં છે. આ શસ ત્ થક થયા કાયમે વૈજ્ઞાનકિ થીતવજન ઘટાડવાને પ્ થપ્ તકથ્વા ૧૨ થી ૧૮ મ્હીનાનો સમ્ય લક ધમં છે. આ શસ ત્ થક થયા જીવનમં ફક તનવુ અને કાયમે જીવન ઉપર નથી લાવતે પણ તેબેજા સ્પૂઠાતની સાથે જોડાયેલા થેગો ઘટાડવા મ્દ કથે છે, જેવા કે મ્હેહનો વકિથ, લોહીનુ અતે ઉરુ દબણ, વંધ્ચત, નહી મ્નાથે સંઘવા, ચમ્ડીની બેમથી વગેથે.

ભચ્ત □ ક નશીવ્વાળો દેશ છે કે જેની પાસે સ્પૂઠાતના શસ ત્ થ્વેદ્ચ છે જે આવી અપૂથ્ વ અને પડકાથ્નાથી શસ ત્ થક થયા કથ્વામં સમ્ય થથે. ડ. શ થીહથી.ઢોથે પાટીલ ભચ્ત્ આ પંક તના પહેલા શસ ત્ થ્વેદ્ચ છે જે પેટના આત્ડા સંધ્તિ Laproscopic અને સ્પૂઠાતના શસ ત્ થ્વેદ્ચ છે. તેથે ખેલબેથ્ ન, □ સ્પૂ ટ્ થેલયાના ડ. ન ડ્ જ્ઞમ્સનની નીરે તલમિ લીધી છે અને જે આવી શસ ત્ થક થયા છેલ્ લા ૨૦ વથ્ થોથી કથે છે. આ તલમિ આગળ વધીને તેથે બેજી તલમિ સ્પૂ વઝિથ્લેન ડ અને ફ્ થન સમં લીધી. ડ. ઢોથે પાટલિ આંત્થય ટ્ થયિ સ્પૂઠાતની શસ ત્ થક થયાનો સંઘ છે તેમા સભ્ચ છે, જે અત્ચંતકસોટી કથ્નાથ ક્ પેતી થ છે, તેપૂણે શસ ત્ થ્વેદ્ચના સંગઠનના પણ પૂથ્ વ અધ્ચક ધ હત.

આજ સુધી ડ.ડી.પી ૩૦ કથ્ત વધથે દથ્દી ની મ્હાથય ટ્ અં સફળાતના દથ્ની સાથેશસ ત્ થક થયા કથી છે. સ્પૂઠાતનુ સહાયત સંઘ □ ક વથ્ ધ પહેલા અત્ચંતપુશ દથ્દી ગંઠતિકથ્ચુ, જેમ્થે બ્ધ લક ધોના અવધ્પુથ કથ્ચા છે અને સુખી અને નથિગી છે.

પેટને સીવવાની (Gastroplasty) પહેલી દથ્દી શ થીમ્.શીથીન શેખ જેની શસ ત્ થક થયા ફેબ્ યુઆથી ૧૯૯૯મં થ્ થતે, તેમુ વજન શસ ત્ થક થયા પહેલા ૧૨૦ કલિો હુત શીથીન કથે છે કે " હું બ્હુ ઉદાસ સંવેદના અનુભવતે હતે. આ શત્ થક થયાને લીધેમૂ વજન ૭૨ કલિો છુ થ્ ગયુ જેને મટે હું ડ કટથ્નો આભથ મનુ છુ કે જેથે હું તેમી પહેલી દથ્દી હોવા છત જોખ્ લીધુ" શ્ચામ્લી દેબ્જે □ ક ૩૮ વથ્ ધની સામજીક કામ્ગાથ છે અને મ્હેહની દથ્દી છે, જેનુ વજન શસ ત્ થક થયા પહેલા ૧૨૪ કલિો હુત અને સપ્ ટેમ્ બ્ ૧૯૯૯મં શસ ત્ થક થયા થ્ ત્ચાથે તેણી કહ્ચુ કે " મૂ ૧૨ મ્હનિામં ૪૮ કલિો વજન છુ થ્ અને મૂ ઉચ લોહીના દબણમં ખાંડનુ પ્ અણ ૩ મ્હનિામં દુથ થ્ ગયુ. હું ચમ્ડીની ઘણી બ્ધી બેમથી થી પીડાતે હતે જેવી કે ખથ્જવુ અને ચમ્ડી ઉપર થી અળાઈ પણ અને તેમા મટે ઘસ પતિલમં પણ દાખલ થ્. મ્ને સાૂ લાગુતહુત અને શાથ્થીક અને મનસકિ થીતેસ વસ થલાગુતહુત મથે આ જીવનનો નવો ભગ હતે. હું પહેલા મનસકિ થ્ બ્હુ ઉદાસ થ્દેતે અને શાથ્થીક થ્ સક થયિ ન હતે. મથી નોકથી અને કુંટુંબની જીદગી બ્હુ દુખ ભેગવવુ પડ્ચુ. ડ.ડી.પી અમથ જેવા સ્પૂઠા લોકો મટે આથ્ શવાદ હત." બેજી અત્ચંતસુખી દથ્દી ફ્થ્ઝાના ખાન કથે છે " હું ૧૨૦ કલિો વજનની સાથેદુખી હતે અને લોકોના ઉપહાસ કથ્નાથી ટીકા સાંભળીને થકી ગઈ હતે. હું વ્ચસ ત્ મ્.જી.થેડ ઉપર મથી દુકાનમં કામ કથ્તે હતે અને આ દથ્ દનાક અનુભવ હતે. આ શસ ત્ થક થયા મથ જીવનમં બ્દલાવ લાવ્ચો હતે અને હવે હું વધથે સ્ વસ થ વ્ચક ત્બની ગઈ. મથી શસ ત્ થક થયા પ્ થલિ ૨૦૦૦મં થ્ અને હવે મૂ વજન ૬૮ કલિો છે." કેપ્ ટન દીનેશંદ્ થ ક સેવાનવિૃત્ તવેપાથી જહાજમં અધકિથી હતે અને જહાજની જીદગી સાથેથ્દેતે. આ જીવનશૈલી સાથેમૂ વજન ૧૫૬ કલિો હુત આજે કથે છે કે "મૂ વજન છુ થ્ને ૯૪ કલિો થ્ ગયુ અને મ્ને સાૂ લાગુતહુત ડ કટથ્ તથે આભથ. હું ઘર છુ કે દથેક સ્પૂઠા વ્ચક ત્ ગંભેથ્તથી આ વકિલ પનો વચિથ કથે અને ફ્થ્જ જાથે." સૌથી વધથે વજનવાળો દથ્દી જેના ઉપર ડ કટથે શસ ત્ થક થયા કથી, તેહતે શ થી.થમ ભેડે જેનુ વજન લગભગ ૨૩૫ કલિો હુત અને તેથે ગસ ટ ૨૦૦૦મં શસ ત્ થક થયા કથ્વાનુ પસંદ કથ્ચુ. ભેડે ઉલ લેખ કથે છે " છેલ્ લા આઠ મ્હનિામં ૬૦ કલિોથી વધથે વજન છુ કથ્ચુ છે અને મ્ને બ્હુ સાૂ લાગે છે. ડોકટથ્નો આભથ જેથે આ પડકાથ સ્ વકિથીને મ્ને જીવનમં મ્દ કથી."

૧૫મી સાંજે OSG અધકિૃતથીતે OSG વૈદ્ચકીય ટ્ થ્સ ટની ઘોષણા કથી. આ અવસથ પ્ થ્પ્ચાતપ્ થંધ્મ વશિષય્ ઝ ડ.પી.સી.સેજવાલકથ પ્ થ્મવશાળી થીતેદ્દ વશિ વાસની સાથેમનતે હતે કે ડ. શ થીહથી.ઢોથે પાટીલે આ પડકાથ સ્ વકિથ્ચો છે. ફક તદથ્દી આ જોખ્ નથી લીધુ ડોકટથ મટે મેટુ જોખ્ છે, જે મને છે કે શસ ત્ થક થયાની કલ પના અને તેમી સફળાત તેમા બ્ધ સુખી દથ્દી નશિ ચ્તિકથી છે. આ ટ્ થ્સ ટ શસ ત્ થક થયા, સ્પૂઠા લોકોના સવાલો અને તેમો ઈલાજ કથ્વા મટે જાગૂકત ફેલાવવા, સ્પૂઠા લોકો મટે સવસિ ત્ પથમ્ શની બેઠકો અને સ્ વાસ થ્ સંધ્તિપ્ થ્વૃત્ મટે જવાબ્દાથ છે.

□□□□□□ □□□□ □□□□ □□□□□□□□ □□□□□□ □□□□ □□□□ □□□□□□ □□□ □□□□□□ □□.

વિજ્ઞાપન પત્રિકા

નગર થેડ, પૂણે - ૪૧૧ ૦૧૪, મહાચમ ટ્રસ્ટ, ભથ્થ

ફોન : + ૯૧ ૨૦ ૨૬૬૮૩૭૧૦ અથવા + ૯૧ ૨૦ ૨૬૬૮૩૭૯૦.

અઠવાડિયાના બધ દવિસો - સમ્ય - સાંજના ૬ થી ૮.

નવુ પથમ્ શ કેન ઇ ઇ ટૂંક સમ્યમં નવી જગત્યા ઉપર ઉઘાડવામં આવશે અને જાહેર કથશે. મહિનાના દરેક જથ બુધ્માટે OSG ની બેઠકો જહાંગીર નથ સગિ હોમ્ના પથસિંવાદના હોલમં સાંજે ૫ વાગતે open house મટે થય છે. બધચને આ સત્ અં જોડાવવા મટે અને નવા સ વસ થજીવનના શબ્ દો ફેલાવવા મટે આમ્ત થય છે.